

# એક માતાનું અભિમાન

~ ગુરુમાઈ ચિદ્રિલાસાનંદ

એવો કયો દિવસ છે

જ્યારે માતાના ગુણગાન ન કરી શકાય?

પોતાની સમયાતીત યાત્રા પર આ બ્રહ્માંડમાં વિચરણ કરતા

ચિતિના આકાશમાં તરી રહેલા

દરેક અજન્મા શિશુના આત્માએ

કોણ જાણે કેવી રીતે આ અદ્ભુત પૃથ્વી ગ્રહ

વિશે જાણી લીધું છે.

પૃથ્વી.

એ આત્મા કેટલો આતુર હશે

એક આશ્રયની શોધમાં

જ્યાં તે સુરક્ષિતતાથી જન્મ લઈ શકે.

આ ગ્રહ પર એક પ્રેમાળ હૃદય,

ભલે આ આત્માની અપેક્ષા કરી રહ્યું હોય કે નહીં,

ભલે તેની અભિલાષા કરી રહ્યું હોય કે નહીં,

પોતાની સત્તામાં તેનું સ્વાગત કરે છે.

નિર્ણયની એક ક્ષણ  
સખત પરિશ્રમ,  
અતિશય વેદના,  
અને હર્ષોલ્લાસનું  
જીવન બની જાય છે.  
તે એક કૃતકૃત્ય ભાગ્ય બની જાય છે.

ભાગ્ય.

એક માતાના  
હર્ષની પરાકાષ્ટા  
કે તેના અસહ્ય કષ્ટની અનુભૂતિને  
કોઈપણ, ક્યારેય પૂર્ણરીતે નથી જાણી શકતું,  
ભલે તેની લાગણીઓની સિસકારીઓ સાંભળી શકાતી હોય  
કે તે તેના મનના ગહન-કાળા અરણ્યમાં ગુસપુસ કરતી હોય.

પણ એક વાત તો નિશ્ચિત છે :  
એક માતાના હૃદયનો  
માત્ર એક જ મનોરથ,  
એક જ પ્રયાસ હોય છે —  
પોતાના સંતાન માટે  
એ કરવું જે આ બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ છે.

એક માતા જેને તેનો લાડકવાયો સોંપવામાં આવ્યો છે,  
તે તેના સંતાન માટે બની શકે એટલી  
સર્વશ્રેષ્ઠ બનવાનો સંઘર્ષ કરતી રહે છે.

ભલે કંઈ પણ થાય

તે અતિશય ગર્વ સાથે

રાતદિવસ

પોતાના સંતાનના સ્વપ્નોને સાકાર કરવામાં કાર્યરત રહે છે.

*ચોવીસે કલાક.*

જ્યારે તેનું સંતાન દુઃખી હોય છે ત્યારે માતા રડે છે.

જ્યારે તેનું સંતાન ખુશ હોય છે ત્યારે માતા હસે છે.

*મારું સંતાન શું કરવા ઇચ્છે છે?*

આ એક માતાનો પહેલો વિચાર હોય છે.

તેના આવેગો અને કામનાઓ

હંમેશાં સીધા તેના હૃદયમાંથી ઉદ્ભવે છે —

તેના ઉત્કૃષ્ટ, વિશાળ હૃદયમાંથી.

*પહેલો વિચાર.*

બની શકે ક્યારેક માતાની જાણ વિના

તેનું સંતાન તેને બેહદ પ્રેમ કરે.

બની શકે ક્યારેક અજાણતામાં સંતાનના

શબ્દ કે કૃત્ય

એ દર્શાવે કે સંતાન માતાનો તિરસ્કાર કરી રહ્યું છે.

તેમછતાં એક માતા પર્વતની જેમ દૃઢ છે.

એક માતા નદીની જેમ ઊંડી છે.

એક માતાનું હૃદય આ બ્રહ્માંડ

અને તેમાંથી ઉદ્ભવતા બધાં ગ્રહો અને આકાશગંગાઓની જેમ વિશાળ છે.

પોતાના કર્તવ્ય પ્રત્યે એક માતાની વચનબદ્ધતા

તેના સંતાનના મનોભાવ કે કાર્યોની

ભરતીઓટ સાથે બદલાતી રહેતી નથી.

તેનું સંતાન તેને એક ઉચ્ચ આસન પર બેસાડે

અથવા તો તેના અદૃશ્ય થઈ જવાની કામના કરે —

એક માતાનું કાર્ય અવિરત

ચાલતું જ રહે છે.

એક માતા અવ્યક્ત નિરાશાઓને પાર કરીને આગળ વધતી રહેશે.

તે અલૌકિક શક્તિ સાથે,

મર્યાદા અને શમસ્થિતિ સાથે,

અગણિત તિરસ્કારપૂર્ણ ટીકા-ટિપ્પણીઓને સહન કરશે,

આકસ્મિક તોફાનોને સહી લેશે.

શા માટે?

કેવી રીતે?

કારણકે તે પ્રેમથી બની છે.

પ્રેમ.

પ્રેમ બધું જ સહન કરી લે છે  
અને એક માતા પ્રેમનું જીવંત પ્રતીક છે.

વર્ષમાં એકવાર માતાને "માતૃદિવસની શુભેચ્છા" આપવાથી

એક માતા જે બધું કરે છે  
તેની મહત્તાને વાસ્તવમાં માપી નથી શકાતી,  
પણ જોવા જઈએ તો કંઈ પણ  
તેના ત્યાગની અસીમ વિશાળતાની  
અથવા તેના પ્રેમાળ અને નિઃસ્વાર્થ હૃદયની ભવ્યતાની  
ક્યારેય બરોબરી નથી કરી શકતું.

તથાપિ, તેને સુખદ માતૃદિવસની શુભેચ્છા આપવાનો

એક નાનકડો પ્રયાસ પણ  
તેના ચહેરા પર એક નિર્મળ સ્મિત લઈ આવશે.

તેના માટે,

એ શુભેચ્છા બધાં કિંમતી રત્નો કરતાં,

જ્ઞાનાર્જનની બધી ઉપલબ્ધિઓ કરતાં,

અને આ સંસારના બધાં યશ કે સન્માન કરતાં પણ વધુ મૂલ્યવાન છે.

એક નાનકડી ભેટ

તેમના તરફથી જેમને તે પ્રેમ કરે છે, જેમનો તે આદર કરે છે,

તેમના તરફથી જે તેની મીઠાશ અને ભલાઈથી ધન્ય થયા છે,

તેમના તરફથી જેમને તેણે બધું જ આપ્યું છે —

તે એક નાનકડી ભેટ  
એક માતાના હાથોમાં આવીને  
અનેકગણી વધીને સહસ્ર સૂર્યોની શક્તિ સમાન બની જશે.

અને તે એક માતા છે એટલે,  
તે ઘણી સ્વાભાવિકતાથી એ શક્તિ  
ધરતી માતાને આપશે.  
તે સમર્થ બનાવી દેશે  
આ પૃથ્વીના એ અનેક લોકને,  
જે તેના સંતાનને પોતાના આલિંગનમાં લઈ લે છે  
અને એ અનેક લોકને પણ જે તેનાં સંતાનોના અંતરમાં  
આકાર લે છે અને વિલીન થઈ જાય છે.

એક માતા છે  
પરિચારક,  
પરિપાલક,  
દિલાસો આપનારી,  
સાંત્વના આપનારી.

એક માતા છે  
એક શિક્ષક,  
એક પ્રશિક્ષક,  
એક સંરક્ષક,  
એક માર્ગદર્શક.

એક માતા એ છે,  
જેના કાન સાંભળવા માટે હંમેશાં તૈયાર અને ગ્રહણશીલ છે,  
જેના હાથ સ્થિર અને વિશ્વાસપાત્ર છે.  
તે એક હીરા સમાન ચમકતી શિલા છે.

'માતા'ની પદવી

માત્ર તેમના માટે સીમિત નથી હોતી જે જન્મ આપે છે.

આ સંસારના ચારે ખૂણામાં,  
અને સમસ્ત જીવયોનિઓમાં,  
એવા અનેક ઉદાર પ્રાણી છે

જેમનું સ્વરૂપ,

જેમની સહજવૃત્તિ છે,

એ બધી ભૂમિકાઓને અપનાવી લેવાની જે એક માતાની છે.

આ સુંદર અને હૃદયસ્પર્શી ઘટના

વારંવાર ઉન્મીલિત થાય છે

અને આ ધરતીમાતાને સહાય કરે છે.

તેથી માતાઓને સમર્પિત આ દિવસે,

તેમના ગુણગાન કરો જે એક અન્ય પ્રાણીને જીવન આપે છે અને

તેનું પાલનપોષણ કરે છે.

તેમને સન્માનિત કરો જે પોતાનું શરીર તેમના માટે અર્પણ કરે છે

જેનામાં કોઈ અન્ય પ્રાણીની સંભાળ રાખવાની લલક હોય છે.

તેમનો આદરસત્કાર કરો જે આગળ વધીને

કોઈ અન્ય પ્રાણીના વિકાસ અને સુખ માટે

પોતાને સમર્પિત કરે છે.

हे माता भगवती, अमने सदैव तारा हृदयमां राखजे.

Mater beneficium nostrum es.

हे मातः! त्वयोक्ते शब्दे शब्दे वयं पश्येम भगवतः प्रकाशम् ।

એક માતા છે

अनोखी

*beispiellos*

卓越している

*ineguagliabile*

એક માતા છે

વિસ્મયવાદ

*excepcional*

अजीस

несравненная

એક માતા છે

*sans pareille*

*unübertroffen*

बेमिसाल

唯一



એક માતા છે

niezrównana

舉世無雙

incomparável

वरेण्य

એક માતા છે

અપ્રતિમ!



© ૨૦૧૯ એસ. વાય. ડી. એ. ફાઉન્ડેશન®. સર્વાધિકાર સુરક્ષિત.